

सूरा  
यासीन



أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

પનાહ માગું છું અલ્લાહ પાસે બહિષ્કૃત શયતાનથી.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

અલ્લાહના નામ વડે કે જે રહમાન અને રહીમ છે.

يَسُّ

યાસીન.

وَالْقُرْآنِ الْحَكِيمِ

કસમ છે હિકમતવાળા કુરઆનની.

أَنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ

બેશક તું રસૂલોમાંથી જ છે.

عَلَى صِرَاطٍ مُسْتَقِيمٍ

સિરાતે મુસ્તકીમ ઉપર.

تَنْزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ

ઈજ્જતવાળા અને રહેમવાળાનું ઉતારેલું છે

يُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤَهُمْ فَهُمْ غٰفِلُونَ

કે જેથી તું ચેતવે એ કોમને કે જેમના વડવાઓને નહોતા ચેતવવામાં

આવ્યા એટલે તેઓ ગાફિલ છે.

لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ﴿٤٥﴾

સાચું સાબિત થઈ ચૂક્યું જ છે આ ફરમાન મોટા ભાગના લોકો પર

તેમ છતાં તેઓ ઈમાન નહીં લાવે.

إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُمْ

مُقْفَحُونَ ﴿٤٦﴾

બેશક અમે મૂકી દીધો છે તેમની ગરદનોમાં એક તોક કે જે તેમની

દાઢીઓ સુધી છે એટલે તેઓ માથું ઊંચું જ રાખે છે.

وَجَعَلْنَا مِنْ بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ

سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ ﴿٤٧﴾

અને અમે મૂકી દીધી છે તેમના સામે એક આડ અને તેમની પાછળ

એક આડ અને તેમને છુપાવી દીધા છે માટે તેઓ નથી જોઈ શકતા.

وَسَوَاءٌ عَلَيْهِمْ ءَأَنْذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ ﴿٤٨﴾

અને સરખું જ છે તેમના માટે તું તેમને ચેતવણી આપે કે ન આપે

તેઓ ઈમાન લાવશે નહીં.

إِنَّمَا تُنذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِيَ الرَّحْمَنَ بِالْغَيْبِ ۗ

فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَأَجْرٍ كَرِيمٍ ﴿٤٩﴾

તું તો એને જ ચેતવણી આપી શકશે કે જે પચરવી કરે ઝિક્કની અને  
ગેબની સાથે રહમાનથી ડરે. માટે તું તેને ખુશખબર આપ મઠ્ઠેરતની

અને મોટા સવાબની.

إِنَّا نَحْنُ نُحْيِي الْمَوْتَىٰ وَنَكْتُبُ مَا قَدَّمُوا وَآثَارَهُمْ وَكُلُّ  
شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ ﴿١٢﴾

બેશક અમો એ ઈએ કે અમે જીવતા કરીએ ઈએ મડદાને અને  
લખીએ ઈએ તેને કે જે કંઈ તેઓ આગળ મોકલે છે અને તેમના  
અવશેષોને પણ. અને દરેક વસ્તુ એવી છે કે અમે તેને સુરક્ષિત કરી

દીધી છે એક સ્પષ્ટ ઈમામમાં.

وَاضْرِبْ لَهُم مَّثَلًا أَصْحَابَ الْقَرْيَةِ إِذْ جَاءَهَا  
الرُّسُلُونَ ﴿١٣﴾

અને તું તેમને દાખલો આપ વસ્તીના લોકોનો જ્યારે કે તેમની પાસે

રસૂલો આવ્યા.

إِذْ أَرْسَلْنَا إِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ  
فَقَالُوا إِنَّا إِلَيْكُمْ مُّرْسَلُونَ ﴿١٣﴾

જ્યારે કે અમે મોકલ્યા તેમના સુધી બે રસૂલોને પણ તે લોકોએ તે  
બન્નેને જૂઠલાવ્યા તો અમે ઈજજત આપી ત્રીજા રસૂલ વડે પછી

ત્રણેય રસૂલો કહેવા લાગ્યા કે બેશક અમે તમારા સુધી મોકલવામાં

આવેલા છીએ.

قَالُوا مَا أَنْتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَمَا أَنْزَلَ الرَّحْمَنُ مِنْ  
شَيْءٍ إِنْ أَنْتُمْ إِلَّا تَكْذِبُونَ ﴿١٥﴾

લોકોએ કહ્યું કે તમે તો અમારા જેવા માણસ સિવાય કંઈ જ નથી  
અને રહમાને કંઈ પણ નથી નાઝિલ કર્યું તમે તો કેવળ જુદું બોલી

રહ્યા છો.

قَالُوا رَبُّنَا يَعْلَمُ إِنَّا إِلَيْكُمْ لَمُرْسَلُونَ ﴿١٦﴾

રસૂલોએ કહ્યું કે અમારો પાલનહાર જાણે છે કે બેશક અમે તમારા

સુધી મોકલવામાં આવેલા રસૂલો છીએ.

وَمَا عَلَيْنَا إِلَّا الْبَلْغُ الْمُبِينُ ﴿١٧﴾

અને અમારા ઉપર સ્પષ્ટ તબ્લીગના સિવાય કોઈ જ જવાબદારી નથી.

قَالُوا إِنَّا تَطَيَّرْنَا بِكُمْ لَئِن لَّمْ تَنْتَهُوا لَنَرْجُمَنَّكُمْ وَ  
لَيَسَّسَنَّكُمْ مِنَّا عَذَابٌ أَلِيمٌ ﴿١٨﴾

લોકોએ કહ્યું કે બેશક અમે તમને અપશુકન માનીએ છીએ. જો તમે  
નહીં રોકાવ તો અમે તમને સંગસાર કરી જ દઈશું અને તમને અડકી

જ જશે અમારા તરફથી એક દર્દનાક સજા.

قَالُوا طَائِرُكُمْ مَعَكُمْ أَإِنِّ دُكِّرْتُمْ بَلْ أَنْتُمْ قَوْمٌ  
مُتَسْرِفُونَ ﴿١٩﴾

રસૂલોએ કહ્યું કે તમારું અપશુકન તો તમારી જ સાથે છે. શું તમને  
યાદ અપાવ્યું એટલા માટે (તમે અપશુકન માનો છો) ? આવું નથી,  
બલકે તમે તો હદ વટાવી દેનારી કોમ છો.

وَجَاءَ مِنْ أَقْصَا الْمَدِينَةِ رَجُلٌ يَسْعَى قَالَ يَا قَوْمِ  
اتَّبِعُوا الْمُرْسَلِينَ ﴿٢٠﴾

અને એક માણસ આવ્યો શહેરના પેલે પારથી દોડતો. તેણે કહ્યું કે  
અય મારી કોમ રસૂલોની પયરવી કરો.

اتَّبِعُوا مَنْ لَا يَسْأَلُكُمْ أَجْرًا وَهُمْ مُهْتَدُونَ ﴿٢١﴾

તમે પયરવી કરો એમની કે જે નથી માગતા તમારાથી કોઈ બદલો  
અને જેઓ હિદાયત પામેલા છે.

وَمَا لِي لَا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٢٢﴾

અને મને શું થયું છે કે હું તેની ઈબાદત ન કરું કે જેણે મને પેદા કર્યો  
છે અને જેની તરફ તમે બધા પાછા જવાના છો ?

أَتَّخِذُ مِنْ دُونِهَا إِلَهًا إِنَّ إِلَهًا لَرَحِيمٌ بَصِيرٌ لَا تُغْنِي  
عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنْقِذُونَ ﴿٢٣﴾

શું હું તેના સિવાય બીજાને ખુદા માની લઉં કે જો રહમાન ઈરાદો કરે કે મને નુકસાન પહોંચાડે તો મને આ બધાની શક્ષાત પણ કોઈ ક્ષાયદો ન પહોંચાડે અને ન તો તેઓ મને છુટકારો અપાવી શકે ?

إِنِّي إِذَا لَفِيَ ضَلَلٍ مُّبِينٍ ﴿٢٣﴾

બેશક હું તો આવી રીતે સ્પષ્ટ ગુમરાહીમાં જ સપડાઈ જઈશ.

إِنِّي أَمَنْتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ ﴿٢٤﴾

બેશક હું ઈમાન લઈ આવ્યો છું તમારા પાલનહાર ઉપર એટલે તમે મને સાંભળો.

قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۗ قَالَ يَلِيَّت قَوْمِي يَعْلمُونَ ﴿٢٥﴾

તેને કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઈ જા. તોણે કહ્યું કે કાશ

મારી કોમ જાણતી હોત !

بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ ﴿٢٦﴾

એટલા માટે કે મારી મગફરત કરી દીધી છે મારા પાલનહારે અને મને બનાવી દીધો છે ઈજ્જતવાળા લોકોમાંથી.

وَمَا أَنْزَلْنَا عَلَى قَوْمِهِ مِنْ بَعْدِهِ مِنْ جُنْدٍ مِّنَ السَّمَاءِ

وَمَا كُنَّا مُنْزِلِينَ ﴿٢٧﴾



અને અમે નથી ઉતાર્યું તેની કોમ ઉપર આ પછી આસમાનમાંથી

કોઈ પણ લશ્કર અને ન તો અમે ઉતારનારા છીએ.

إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَإِذَا هُمْ خُمُودٌ ﴿٢٩﴾

તે તો કેવળ એક ગજના જ હતી અને ત્યાર પછી તેઓ

શાંત પડી ગયા.

يَحْسِرَةٌ عَلَى الْعِبَادِ ۗ مَا يَأْتِيهِمْ مِنْ رَسُولٍ إِلَّا كَانُوا بِهِ

يَسْتَهْزِءُونَ ﴿٣٠﴾

કેવો અફસોસ છે બંદાઓ ઉપર ! કોઈ પણ રસૂલ તેમના સુધી નથી

પહોંચતો કે તેઓ તેની મશ્કરી કરતા થઈ જાય છે.

أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنَ الْقُرُونِ أَنَّهُمْ

إِلَيْهِمْ لَا يَرْجِعُونَ ﴿٣١﴾

શું આ લોકો નથી જોતા કે કેટલી બધી વસ્તીઓને તેમના પહેલાં અમે

હલાક કરી દીધી છે કે તેઓ તેમની તરફ પાછા ફરી શકતા જ નથી ?

وَإِنْ كُلُّ نَسْأَةٍ لَدَيْنَا مُحْضَرُونَ ﴿٣٢﴾

એ છતાંય કે આ બધા જ એ સમયે અમારી તરફ હાજર

કરવામાં આવશે.

وَآيَةٌ لَهُمُ الْأَرْضُ الْمَيْتَةُ ۚ أَحْيَيْنَاهَا وَأَخْرَجْنَا  
مِنْهَا حَبًّا فَمِنْهُ يَأْكُلُونَ ﴿٣٣﴾

અને આ લોકો માટે નિશાની સૂકી જમીન છે. અમે તેને સજીવ કરી  
દીધી અને અમે કાઢ્યા તેમાંથી દાણા કે જે આ લોકો ખાય છે.

وَجَعَلْنَا فِيهَا جَنَّاتٍ مِّنْ نَّخِيلٍ وَأَعْنَابٍ وَفَجْرْنَا فِيهَا  
مِنَ الْعُيُونِ ﴿٣٤﴾

અને અમે તેમાં બગીચાઓ બનાવ્યા ખજૂરના અને દ્રાક્ષના અને  
અમે તેમાં ઝરણાં વહેતાં કર્યાં.

لِيَأْكُلُوا مِنْ ثَمَرِهِ ۚ وَمَا عَمِلَتْهُ أَيْدِيهِمْ ۖ أَفَلَا يَشْكُرُونَ ﴿٣٥﴾

કે જેથી આ લોકો તેનાં ફળો ખાય એમ છતાંય કે આ તેમના હાથોનો

અમલ નથી. શું તોય આ લોકો શુક્ર નહીં કરે ?

سُبْحَانَ الَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا مِمَّا تُنْبِتُ الْأَرْضُ وَ  
مِنَ أَنْفُسِهِمْ ۚ وَمِمَّا لَا يَعْلَمُونَ ﴿٣٦﴾

પાક છે તે કે જમીન ઉગાવે છે તે બધાના અને આ લોકોના પોતાના  
જેણે જોડા બનાવ્યા અને એ વસ્તુઓ બનાવી કે જેમના વિષે આ

લોકો કંઈ જ નથી જાણતા.

وَآيَةٌ لَهُمُ الْيَلُّ ۚ نَسَخْنَا مِنْهُ النَّهَارَ فَاذَاهُمْ ۚ مُّظْلِمُونَ ﴿٣٧﴾

અને આ લોકો માટે નિશાની છે રાતની. અમે બહાર કાઢીએ છીએ તેની અંદરથી દિવસને જ્યારે કે આ લોકો અંધકારમાં પડ્યા હોય છે.

وَالشَّمْسُ تَجْرِي لِمُسْتَقَرٍّ لَهَا ۗ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ  
الْعَلِيمِ ﴿٣٨﴾

અને સૂરજ પણ (એક નિશાની છે) કે જે પોતાની ધરી ઉપર ચાલતો રહે છે. આ છે ઈજ્જતવાળા અને જાણકાર (અલ્લાહ)ની તકદીર.

وَالْقَمَرَ قَدَّرْنَاهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَالْعُرْجُونِ الْقَدِيمِ ﴿٣٩﴾

અને ચાંદ પણ (એક નિશાની છે) કે જેની મંઝિલો અમે નિર્ધારિત કરી દીધી છે એટલે સુધી કે તે પાછો ખજૂરની સૂકી ડાળી જેવો

થઈને એ જ જગ્યાએ આવી જાય છે.

لَا الشَّمْسُ يَنْبَغِي لَهَا أَنْ تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ  
النَّهَارِ ۗ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ ﴿٤٠﴾

ન તો સૂરજ માટે શક્ય છે કે ચાંદને પકડી લે કે ન તો દિવસ કરતાં રાત આગળ નીકળી શકે છે. અને આ બધા આસમાનમાં તર્યા જ કરે છે.

وَآيَةٌ لَهُمْ أَنَّا حَمَلْنَا ذُرِّيَّتَهُمْ فِي الْفُلِكِ الْمَشْحُونِ ﴿٤١﴾

અને આ લોકો માટે નિશાની છે કે અમે તેમની નસલોને ભરેલી

કશ્તીમાં સવાર કરી.

وَخَلَقْنَا لَهُمْ مِنْ مِثْلِهِ مَا يَرْكَبُونَ ﴿٣٢﴾

અને અમે તેમના માટે આના જેવી બીજી વસ્તુઓ પણ બનાવેલી

છે કે જેમના ઉપર તે સવારી કરે છે.

وَإِنْ نَشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيحَ لَهُمْ وَلَا هُمْ يُنْقَذُونَ ﴿٣٣﴾

અને જો અમે ઈચ્છતા તો તેમને ગરકાવ કરી દેતા પછી તેમની ફરિયાદ

સાંભળનાર કોઈ ન હોત અને તેઓને છુટકારો પણ ન મળત.

إِلَّا رَحْمَةً مِنَّا وَمَتَاعًا إِلَىٰ حِينٍ ﴿٣٤﴾

સિવાય કે અમારા તરફની રહેમત અને એક મુદ્દત સુધીની સગવડ.

وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ

لَعَلَّكُمْ تُرْحَمُونَ ﴿٣٥﴾

અને જ્યારે કહેવામાં આવે છે તેમને કે તમે તકવો કરો જે કંઈ તમારી

સામે છે તેનો અને જે તમારી પાછળ છે તેનો કે કદાચ તમારા ઉપર

રહમ કરવામાં આવે.

وَمَا تَأْتِيهِمْ مِنْ آيَةٍ مِنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا

مُعْرِضِينَ ﴿٣٦﴾

અને તેમના રબની આયતોમાંથી કોઈ પણ આયત તેમની પાસે નથી

આવતી સિવાય કે તેઓ તેનાથી કંટાળેલા હોય છે.

وَإِذَا قِيلَ لَهُمْ أَنْفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا  
لِلَّذِينَ آمَنُوا أَنْطَعِمُ مَنْ نَوَيْشَاءَ اللَّهِ اطْعَمَهُ ۗ إِنَّ أَنْتُمْ

إِلَّا فِي ضَلَالٍ مُّبِينٍ ﴿٣٤﴾

અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે રોજી તમને  
આપેલી છે તેમાંથી ખર્ચ કરો તો જે લોકોએ કુફર કર્યું તે લોકો કહે છે  
જે લોકો ઈમાન લાવ્યા તેમને કે શું અમે તેને ખવડાવીએ કે જેને જે  
અલ્લાહ ઈચ્છત તો પોતે જ ખવડાવી દેત ? તમે તો કેવળ ખુલ્લી

ગુમરાહીમાં છો.

وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صَادِقِينَ ﴿٣٨﴾

અને તેઓ કહે છે કે આ (ક્યામતનો) વાયદો ક્યાં ગયો જે તમે સાચા

હતા તો ?

مَا يَنْظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّسُونَ ﴿٣٩﴾

આ લોકો કેવળ એક ગર્જનાની રાહ જેઈ રહ્યા છે કે જે તેમને

ઝપટમાં લઈ લેશે જ્યારે કે તેઓ વાદવિવાદ કરી રહ્યા હશે.

فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَىٰ أَهْلِهِمْ يَرْجِعُونَ ﴿٥٠﴾

ત્યારે તેઓ વસિયત પણ નહીં કરી શકે અને ન તો તેઓ તેમના

સગાવહાલાઓ તરફ પાછા ફરી શકશે.

وَنُفِ فِي الصُّورِ فَأِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنْسِلُونَ ﴿٥١﴾

અને સૂરની અંદર ફૂંકવામાં આવશે તો ત્યારે આ લોકો પોતાની

કબરોમાંથી પોતાના પાલનહાર તરફ દોડતા ચાલ્યા જશે.

قَالُوا يَوْمَئِذٍ لَّيْسَ مِنَّا وَمَنْ بَعَثْنَا مِن مَّرْقَدِنَا ۚ هَذَا مَا وَعَدَ

الرَّحْمَنُ وَصَدَقَ الْمُرْسَلُونَ ﴿٥٢﴾

તેઓ કહેશે કે અફસોસ થાય અમારા ઉપર ! કોણે અમને અમારી

કબરોમાંથી ઊભા કર્યા ? આ છે જે કંઈ વાયદો કર્યો હતો રહમાને

અને રસૂલો સાચું કહેતા હતા.

إِنْ كَانَتْ إِلَّا صَيْحَةً وَاحِدَةً فَأِذَا هُم جَمِيعٌ لَّدَيْنَا

مُحْضَرُونَ ﴿٥٣﴾

એ તો કેવળ એક ગર્જના જ હશે તો પછી આ લોકો બધાય અમારી

તરફ હાજર કરવામાં આવશે.

فَالْيَوْمَ لَا تُظَلَمُ نَفْسٌ شَيْئًا وَلَا تَجْرُونَ إِلَّا مَا كُنتُمْ

تَعْمَلُونَ ﴿٥٤﴾

તો તે દિવસે કોઈ પણ નફસ ઉપર જરાય જુલમ કરવામાં નહીં આવે

અને ન તો તમને બદલો આપવામાં આવશે સિવાય કે જે કંઈ તમે

કરી રહ્યા હતા.

إِنَّ أَصْحَابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغْلٍ فَكِهِونَ ﴿٥٥﴾

બેશક જન્નતના લોકો એ દિવસે પ્રવૃત્તિમાં ખુશખુશાલ હશે.

هُم وَأَزْوَاجُهُمْ فِي ظِلِّ عَلَى الْأَرَآئِكِ مُتَّكُونَ ﴿٥٦﴾

તેઓ અને તેમના સાથીઓ છાંયડામાં તખ્ત ઉપર ટેક લગાવીને

બેઠેલા હશે.

لَهُمْ فِيهَا فَاكِهَةٌ وَلَهُمْ مَّا يَدَّعُونَ ﴿٥٧﴾

તેની અંદર તેમના માટે હશે ફળો અને તેમના માટે હશે જે કોઈ

વસ્તુની તેઓ ઈચ્છા કરશે.

سَلَامٌ قَوْلًا مِّن رَّبِّ رَحِيمٍ ﴿٥٨﴾

“સલામ.” આ ફરમાન હશે રહમવાળા પાલનહાર તરફથી.

وَأَمَّا زُورًا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ ﴿٥٩﴾

“અને અલગ થઈ જાઓ આજના દિવસે અય ગુનેગારો !”

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَبْنَىٰ أَدَمَ أَنْ لَا تَعْبُدُوا الشَّيْطَانَ ﴿٦٠﴾

إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ﴿٦٠﴾

“શું મેં વાયદો નહોતો લીધો તમારાથી અય આદમની ઓલાદ ! કે

ઈબાદત ન કરજો શયતાનની ? બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.”

وَ أَنْ اَعْبُدُونِي ۗ هَذَا صِرَاطٌ مُسْتَقِيمٌ ﴿١١﴾

“અને એ કે મારી ઈબાદત કરો. આ જ સિરાતે મુસ્તકીમ છે.”

وَلَقَدْ أَضَلَّ مِنْكُمْ جِبِلًّا كَثِيرًا ۗ أَفَلَمْ تَكُونُوا

تَعْقِلُونَ ﴿١٢﴾

“અને તેણે તો તમારામાંથી ઘણા બધા ટોળાઓને ગુમરાહ કરી

દીધા. તો શું તમે વિચાર નહોતા કરતા રહેતા ?”

هَذِهِ جَهَنَّمُ الَّتِي كُنْتُمْ تُوعَدُونَ ﴿١٣﴾

“આ છે એ જહન્નમ કે જેના વિષે તમને વાયદો કરવામાં

આવ્યો હતો.”

إِصْلَوْهَا الْيَوْمَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ ﴿١٤﴾

“તમે તેમાં શેકાવ આજના દિવસે એ કારણે કે જે કંઈ કુફ્ર તમે કરતા

રહેતા હતા.”

الْيَوْمَ نَخْتِمُ عَلَىٰ أَفْوَاهِهِمْ وَتُكَلِّمُنَا أَيْدِيهِمْ وَتَشْهَدُ

أَرْجُلُهُمْ بِمَا كَانُوا يَكْسِبُونَ ﴿١٥﴾

એ દિવસે અમે મહોર લગાવી દઈશું તેમના મોઢાઓ ઉપર અને

અમે બોલવાની શક્તિ આપીશું તેમના હાથોને અને ગવાહી આપશે

તેમના પગો એ કારણે કે જે કંઈ તેઓ કમાણી કરી રહ્યા હતા.



وَلَوْ نَشَاءُ لَطَمَسْنَا عَلَىٰ أَعْيُنِهِمْ فَاسْتَبَقُوا الصِّرَاطَ  
فَأَنَّىٰ يُبْصِرُونَ ﴿٦٦﴾

અને જો અમે ઈચ્છતા તો અમે ભૂસી નાખતા તેમની આંખોને તે પછી  
તેઓ રસ્તા તરફ આગળ વધતા તો કેવી રીતે જોઈ શકવાના હતા ?

وَلَوْ نَشَاءُ لَمَسَخْنَاهُمْ عَلَىٰ مَكَانَتِهِمْ فَمَا اسْتَطَاعُوا  
مُضِيًّا وَلَا يَرْجِعُونَ ﴿٦٧﴾

અને જો અમે ઈચ્છતા તો તેમને પોતાની જગ્યાએ જ રૂપાંતરિત કરી  
નાખતા પછી તેઓ ન તો આગળ વધી શકતા કે ન તો પાછા  
આવી શકતા.

وَمَنْ نُعَبِّرْهُ نُنَكِّسْهُ فِي الْخَلْقِ ۗ أَفَلَا يَعْقِلُونَ ﴿٦٨﴾

અને જેને અમે ઉંમર આપી તેને તેની પ્રકૃતિમાં ઘટાડો કરી નાખીએ  
છીએ. તો શું તોય તેઓ વિચાર નથી કરતા ?

وَمَا عَلَّمْنَاهُ الشِّعْرَ وَمَا يَنْبَغِي لَهُ ۖ إِنْ هُوَ إِلَّا ذِكْرٌ وَ  
قُرْآنٌ مُّبِينٌ ﴿٦٩﴾

અને અમે આને (એટલે કે રસૂલલ્લાહને) શાયરી નથી શીખવાડી  
અને આવું આને શોભતું પણ નથી. આ તો કેવળ ઝિક્ર છે અને  
સ્પષ્ટ કુરઆન છે.

لِيُنذِرَ مَنْ كَانَ حَيًّا وَيَحِقَّ الْقَوْلُ عَلَى الْكٰفِرِيْنَ ﴿٤٠﴾

એટલા માટે કે આ ચેતવણી આપી શકે જે જીવતો હોય તેને અને

કાફિરો ઉપર ફરમાનને સાચું સાબિત કરી બતાવે.

أَوَلَمْ يَرَوْا أَنَّا خَلَقْنَا لَهُمْ مِمَّا عَمِلَتْ أَيْدِيْنَا أَنْعَامًا فَهُمْ

لَهَا مٰلِكُونَ ﴿٤١﴾

શું આ લોકો નથી જોતા કે અમે તેમના માટે તે પણ સજ્યું છે કે જે

અમારા હાથોનું કાર્ય છે અને એ છે જાનવરો એટલા જ માટે આ

લોકો તેમના માલિક થઈ શકે છે.

وَذَلَّلْنَاهَا لَهُمْ فَمِنْهَا رَكُوبُهُمْ وَمِنْهَا يَأْكُلُونَ ﴿٤٢﴾

અને અમે તેમને આ લોકો માટે પાલતું બનાવી દીધા છે કે એટલે

તેમનામાંથી આ લોકોની સવારી છે અને તેમનામાંથી આ લોકો

ખાય પણ છે.

وَلَهُمْ فِيهَا مَنَافِعُ وَمَشَارِبٌ ۗ أَفَلَا يَشْكُرُونَ ﴿٤٣﴾

અને તેમનામાંથી આ લોકો માટે મુનાફાઓ પણ છે અને પીણાં પણ

છે. શું તોય આ લોકો શુક્ર નથી કરતા ?

وَاتَّخِذُوا مِنْ دُونِ اللَّهِ إِلَهًا لَّعَلَّهُمْ يُنصَرُونَ ۗ ﴿٤٤﴾

અને અપનાવી લે છે અલ્લાહ સિવાય બીજા ખુદાઓને કે કદાચ

તેઓ આ લોકોની મદદ કરે.

لَا يَسْتَطِيعُونَ نَصْرَهُمْ ۗ وَهُمْ لَهُمْ جُنْدٌ مُّحَضَّرُونَ ﴿٤٥﴾

તેઓ મદદ નહીં કરી શકે આ લોકોની અને તેઓ તો આ લોકોનાં

એવાં ટોળા છે કે જેમને પણ હાજર કરવામાં આવશે.

فَلَا يَخْزِنُكَ قَوْلُهُمْ ۗ إِنَّا نَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ﴿٤٦﴾

તો આ લોકોના શબ્દો તને દુઃખી ન કરે. બેશક અમે જાણીએ છીએ

જે કંઈ આ લોકો છુપાવે છે અને જે કંઈ જાહેર કરે છે તેને.

أَوَلَمْ يَرِ الْإِنْسَانَ أَنَّا خَلَقْنَاهُ مِنْ نُطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ

مُّبِينٌ ﴿٤٧﴾

અને શું ઈન્સાન નથી જોતો કે અમે તેનું સર્જન કર્યું છે એક

નુદ્ધામાંથી તેમ છતાંય તે થઈ જાય છે ખુલ્લો વાદવિવાદ કરનારો.

وَضَرَبَ لَنَا مَثَلًا ۗ وَنَسِيَ خَلْقَهُ ۗ قَالَ مَنْ يُحْيِي الْعِظَامَ وَ

هِيَ رَمِيمٌ ﴿٤٨﴾

અને અમને દાખલા આપે છે અને પોતાની પ્રકૃતિ ભૂલી જાય છે !

કહે છે કે કોણ હાડકાંને જીવિત કરશે જ્યારે કે તે કોહવાઈ

ગયેલાં હશે ?

قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۗ وَهُوَ بِكُلِّ خَلْقٍ  
عَلِيمٌ ﴿٤٩﴾

તું કહી દે કે જીવિત કરશે તેમને એ જ કે જેણે સર્જન કર્યું તેમનું  
પ્રથમ વાર. અને તે તો દરેક સર્જન વિષે જાણનાર છે.

الَّذِي جَعَلَ لَكُم مِّنَ الشَّجَرِ الْأَخْضَرِ نَارًا فَإِذَا أَنْتُمْ  
مِّنْهُ تُوقَدُونَ ﴿٥٠﴾

તે એ છે કે જેણે તમારા માટે લીલા ઝાડમાંથી આગ બનાવી તો  
પછી તમે તેમાંથી આગ ચાંપી શકો છો.

أَوَلَيْسَ الَّذِي خَلَقَ السَّمَوَاتِ وَالْأَرْضَ بِقَدِيرٍ عَلَىٰ أَن  
يَخْلُقَ مِثْلَهُمْ ۗ بَلَىٰ ۗ وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ ﴿٥١﴾

અને શું જેણે આસમાનો અને જમીનનું સર્જન કર્યું તે કુદરત નહીં  
ધરાવતો હોય કે તેમના જેવું બીજું સર્જન કરે ? જરૂર, અને તે તો  
જાણકાર સર્જક છે.

إِنَّمَا أَمْرُهُ إِذَا أَرَادَ شَيْئًا أَن يَقُولَ لَهُ كُنْ فَيَكُونُ ﴿٥٢﴾

તેનો હુકમ તો કેવળ એ જ છે કે જ્યારે તે કોઈ પણ ઈરાદો કરે છે  
ત્યારે તે કહે છે તેને કે થઈ જા તો તે થઈ જાય છે.

فَسُبْحَانَ الَّذِي بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٨٣﴾

તો પાક છે તે કે જેના હાથમાં હુકૂમત છે દરેક વસ્તુની. અને તેની

તરફ જ તમે પાછા જનારા છો.

صَدَقَ اللَّهُ الْعَلِيُّ الْعَظِيمُ

وَصَدَقَ رَسُولُهُ النَّبِيُّ الْكَرِيمُ

બુલંદ અને મહાન અલ્લાહે સાચું કહ્યું, અને તેના રસૂલે કે જે

કરામતવાળા નબી છે તેમણે પણ સાચું કહ્યું.